



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૬/૦૬/૨૦૧૯ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૭૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૨૫ કેસ કરી, ૧૦૧ વ્યક્તિઓને ઝડપી, ૫૨૪ લીટર દેશી દારૂ, ૧૦૨ બોટલ ઈંગ્લીશ દારૂ, ૩ સ્ફૂટર અને ૧ રિક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૧૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૧,૫૫૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૭૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૭૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૦ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૦૮૦/૧૯

ચાંદખેડા: ઇન્દુબહેન કીશનકુમાર સોલંકી (ઉ.વ.૪૫)(રહે. કાળીગામ વાલ્મીકીવાસ સાબરમતી) એ તા.૨૫/૦૬/૧૯ નારોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે આશરે ત્રણેક માસ અગાઉ થી તા.૩૦/૦૧/૨૦૧૯ બપોર ૧૨/૩૦ વાગ્યા દરમિયાન સોમેશ્વર સોસાયટી મકાન નંબર સી/૫ આગળ તથા ગાંધીનગર કોર્ટ કમ્પાઉન્ડ ખાતે આરોપી (૧) દલાલ શંકર ઉર્ફે સંજય (જેનું પુરુ નામ સરનામું જાણવા મળેલ નથી) તથા (૨) મન્સુરી મોહંમદ સરશદ (રહે. સર્જેરી એપાર્ટમેન્ટ પેથાપુર ગામ તા.જી.-ગાંધીનગર) નાઓએ ભેગા મળી મકાનની લોન મંજૂર કરાવવા સારૂ દલાલી પેટે રૂપિયા ૫૦,૦૦૦/- તથા મકાનના બાનાખત પેટે રૂપિયા ૨,૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩,૦૦,૦૦૦/- મેળવી લઈ નાસી જઈ ઇન્દુબહેન સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.આર.પટેલ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૦૮૧/૧૯

સાબરમતી: આનંદભાઈ સાગરભાઈ દેસાઈ (રહે.રામદેવપીર મંદીરની બાજુમા શિવદર્શન સોસાયટી સામે ત્રાગડ રોડ સાબરમતી) એ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૪/૦૬/૧૯ રાતના ૧૧/૦૦ થી તા.૨૫/૦૬/૧૯ કલાક ૪/૩૦ વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી, પગના ચાંદીના કડા નંગ-૨, હાથના ચાંદીના ચુડા નંગ-૨ અને રોકડ રૂપિયા ૨૪,૦૦૦/-, મળી કુલ રૂપિયા ૪૪,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.એમ.રાઠોડ ચલાવે છે.

મણીનગર: નવીનચંદ્ર પોપટલાલ પંચાલ (ઉ.વ.૬૨)(રહે.ચંદ્રપુનમ એપાર્ટમેન્ટ સ્વામિનાયારણ કોલોની સેલત ભુવન બસ સ્ટેન્ડની બાજુના ખાંચામાં રામબાગ મણીનગર) એ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૦૬/૧૯ બપોરના ૩/૩૦ થી સાંજના ૭/૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, સોનાના દાગીના કિંમત રૂપિયા ૫,૮૦,૦૦૦/-, ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૪,૫૦,૦૦૦/- અને રોકડ રૂપિયા ૨૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩૫,૩૦,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ. શ્રી એસ.એમ.પટેલ ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૧૦૮૨/૧૯

બાપુનગર: એજાજહુસેન જૈનુદીન પઠાણ (રહે.બ્લોક નં ૧૦૪/૧૭૭૮ સુંદરમનગર ગુજરાત બોટલિંગ પાસે રખિયાલ રોડ) એ તા.૨૩/૦૬/૧૯ રાતના ૧૧/૦૦ વાગ્યાના સુમારે બાપુનગર સુંદરમનગરના મેદાનમાં પોતાની ટાટા કંપનીનું આઇવા ડમ્પર નંબર જીજે.૦૧.ડીવી.૨૩૫૬ કિંમત રૂપિયા ૧૨,૦૦,૦૦૦/- પાર્ક કર્યું હતું. જેની ચોરી તા.૨૪/૦૬/૧૯ કલાક ૬/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ એજાજહુસેન પઠાણ એ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી જી.એસ.ચૌધરી ચલાવે છે.

વિજ થાંભલા પરથી પડી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૦૮૩/૧૯

ઓઢવ: અકબરભાઈ મહંમદભાઈ મંસુરી (ઉ.વ.૪૮)(રહે. મંસુરીવાસ, મહીસાગર મંદીર પાસે, કઠવાડા ગામ તા-દસ્ક્રોઇ, જી.અમદાવાદ) તા.૨૫/૦૬/૨૦૧૯ સાંજના ૬/૩૦ વાગ્યાના સુમારે સીંગરવા ભગવતીનગર G.S.P.કંપનીની પાછળ ઇલેક્ટ્રીક થાંભલા પાસે ઇલેક્ટ્રીકનું કામ કરતા હતા દરમ્યાન થાંભલા પરથી નીચે પડી જવાથી, માથાના ભાગે ઇજા થતા સારવાર માટે તેમને સીંગરવાગામ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પર ના ડો.શ્રીએ સાંજના ૭/૦૦ વાગે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી જીવસિંહ તીતસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.